

## Appendix - 1

નું

પત્રશિષ્ટ - ૧

મહાકવિ કાલિદાસને પૂર્વ અને પત્રશિષ્ટમના વિદ્વાનો  
અને સાંજીત્યકારો - સાંજીત્યરસિકોએ આપેલી ઓળખિઓમણી  
કેટોક આવી છે:

- : ૧: યસ્યાશ્વીર: ચિરુરનિકાંતો કર્ણ પૂરો મયૂરો  
માસો હાસ: કવિનુલગુરુ: કાલિદાસો વિલાસ:।  
હથો હર્ષ: હૃદયુવસતિ: પદ્મબાળસ્તુ બાણ:  
શબાં નૈષાં વથય નવિતાનામિની કૌતુકાય ॥૧॥
  - : ૨: નિર્ગતાસુ નવા કદ્ય કાલિદાસસ્ય સુચિત્તષુ  
ગ્રીતિર્મધુરણાન્દ્રાસુ મબરીઘ્રવ જાયતે ॥૩॥
  - : ૩: સાર્વતમદ્ધુરસંક્રદુ કોચિલવિલાસિની કંઠકુ જિતપ્રાયે  
શિર્ષાસમયેપિ મુદે રતલીલા કાલિદાસોધિત: ॥૩॥
- 

૧. આમાં મહાકવિ કાલિદાસને કુવિતા કામણીના વિદ્વાસ  
તરીકે ઓળખાયા છે. તેમણી શૈલીનું લાલિત્ય, શૂગાર  
રસપ્રધાન રચનાઓ, અને કલામય નિર્દ્ધારણ કરતી વૈદ્ધી  
શૈલી એતાં તેમને કુવિતા સુંદરીની છટા તરીકે વર્ણાયા  
છે તે યથાર્થ છે.

જ્યોતિષ, પ્રસાન રાધિ, ૧, ૩૨.

૨. મહાકવિ બાણ, હર્ષશિરતના ભગવા રલોકોમાં
૩. ગોવધનાયાર્ય, આચાર્ણસાતશતી - ભગવા રલોક - ૩૫

- (४) भासो रामिल सौमिलौं करनचिः श्री साहसांकः कविः ।  
मेणठो भार कालिदासत्वला॑ः स्कन्धः सुजन्युगच्यः ।  
दण्डी बाणाद्विकरा गणपतिः कान्तईच रैन्नाकरः  
सिद्धापस्य सरस्वती भगवती कैतस्य सर्वे मिये ॥४॥
- (५) भासश्चैरो म्यरो मुहूरिपुरपरो भारविः सारविधः  
श्री हर्षाः कालिदास॑ कविरथभवमृत्यात्ययो भोजराजः ।  
श्रीदण्डी डिपिडमारव्यः श्रुतिमुकुटगुणः मल्लवोभृ बाणः  
स्थाताश्चान्ये सुबन्धुवादय इहलृसिभिर्विश्वमाह॒ लादयन्ति ॥५॥
- (६) एको पि जीयते हन्त कालिदासो न केन चित् ।  
शृंथारे ललितोदृगारे कालिदासक्षमी किमु ॥६॥
- (७) येतायोजि जिनकेश्मस्थिरर्थं विद्यां कविकिना जिनवेश्म ।  
सज्यतां रक्तीर्तिः कविताश्रित कालिदासभारति कीर्तिः ॥७॥
- (८) श्री कालिदास कविकर्त्ता सरस्वतीयम्  
किंवर्ण्यास्यतिरां रसवाहिनीति ।  
यत्कृष्णकरा भगवती शुचिभाव्योगा  
द्वस्थाम्हो मुहरनुग्रहमादशाति ॥८॥
- (९) कालिदासः गिरासारं कालिदासः सरस्वती ।  
चतुर्मुखोऽथवा साक्षात् विदुर्नान्येतु मादशाः ॥ ९ ॥
- (१०) अनधा गुण संपूर्णा समुक्तविच्छिन्निवृति रोतिरसौ ।  
प्रस्तुत रससंदेहा सरस्वती ज्यति कालिदासस्य ॥१०॥

#### क्रमांक

४-२। ज्ञेयर, शक्ति२५ ध्यानि-१८८

५-हृषकवगुण १६३ १६४-५४८

६-२। ज्ञेयर-सूचितमुक्ता वली

७। श्रीकृष्णलिलाक्षण्य १. ६३४-५४८ शक्ति२५५ (पुलकेशी भीजनोः)

८-विठ्ठोवायस्युप- सु १६४-५४८

९। श्रीकृष्णवर कालिदासनी आवाणी ७. लेम० भगवती कालिकामे

१०। विव्र भावना योगे तेना पर विशेष अनुग्रह क्यों छे तेने हु विशेष शु वर्णावृ ?

तेम० :१: तेना पर हेवी कालिकाना अनुग्रहनी दृतकथानो उल्लेख ७. २

१२। सवार्थनी कही छे. तेम० कालिका॑: ऐसे वादगोनी पञ्चितनो ऐ अनुग्रह छे

: मैथहूतः, तथा तेम० पवित्र भजित छे : अथवा शुचिः अथैत आष१६ मासनु

सर्वनिध्य छे: ऐस अर्थ छे.

१३-मक्षितनाथ

१०-अस्त्रिराम

- (११) धन्वतरिहापणां भूमिहिंशं द्वः  
वेताभमद्य धटकपर कालिदासा ॥  
स्थातो वराह मिहिरो नृपतेः सभायाम्  
रत्नानिवै वररनचिर्विव किञ्चमस्य ॥११॥
- (१२) बालमीक्रेजनि प्रकाशितगुणा व्यासेन लीलावती  
वैद्यर्थी कविता स्वयंवृत्तवती श्री कालिदासं वरम् ।  
यासूतामर सिंहमाघ धनिकान् सेप्य जरानीक्षा  
शून्यालंकरणा सखलन्मूपदा कृष्णानं नाश्रिता ॥१२॥
- (१३) उपमा कालिदासस्य भासूरथगारवम् ।  
दण्डनः पदलालित्यं माधवन्तिक्षयो गुणाः ॥१३॥
- (१४) उपमा कालिदासस्य नोत्कृष्टेति मतंमम् ।  
अर्थान्तरस्य विन्यासे कालिदासो विशिष्यते ॥१४॥
- (१५) काव्येषु नाठकं रस्यं तत्राम्या शाकुन्तला ।  
तत्रापि च चतुर्थोऽकः अक्र-ज्ञक्तव्यक्तव्यतः ॥  
तत्रालोकचतुर्थैर्यम् ॥१५॥
- (१६) कालिदासस्य सर्वस्वभमित्तानशाकुन्तलम् ।  
तत्रापि च चतुर्थोऽकः यत्र याति शाकुन्तला ॥१६॥
- (१७) शाकुन्तले चतुर्थोऽकः सर्वोत्कृष्ट इतिप्रथा ।  
न सर्वसंमतं यस्मात् पंचमोऽस्ति ततो धिकः ॥१७॥
- (१८) पुराकवीनां गणनाप्रसंगे  
कनिष्ठिकाधिष्ठिकालिदासा ।  
अद्यापि ततुल्यकवेरभावात्  
अनामिका सार्थकती बभूव ॥१८॥
- (१९) कव्यः कालिदासाद्याः कव्यः कव्यमव्यमी ।  
पर्वतै परमाणौ च पदार्थत्वं प्रतिष्ठितम् ॥

११—ज्योहृतिर्षिद१५२४,

२१—२२, १०

१२—को४नु

१३—को४नु

१४—को४नु

१५—को४नु

१६—को४नु

१७—को४नु

१८—को४नु

१९—को४नु

- (२०) कविरमरः कविरच्छः कविरत्रिनन्दशक्तालिदासश्च ।  
अन्येकव्यः कप्यः वापलुमात्रं परं दधति ॥२०॥
- (२१) क्यमपि कव्यः कव्यः कव्यो पि च कालिदासाद्याः ।  
हुषादो भवन्त्वद्षादः विन्तामण्यो पि हा दुषादः ॥२१॥
- (२२) कालिदास कविता नवीन्यः  
माहिषांदघि सशर्करंपयः ।  
शरदेन्दुरबलाच कोमला  
स्वर्ग सौख्यमुपमुंजतेराः ॥२२॥
- (२३) वैदर्भीरीति संदर्भे कालिदासो प्रगल्भते ॥२३॥
- (२४) सुयशाकालिदासस्य मन्दाकृत्वा प्रवलगति ।  
सदश्वदमस्येव लाघ्वोजतुरगांगना ॥२४॥
- (२५) श्री कालिदासस्य व चो निवार्य  
नेवान्यकाव्ये रमतेमध्ये ।  
किं पारिजातं परिहृत्य हन्त  
भृंगालिरानन्दति सिन्धुवारे ॥२५॥
- (२६) रसभारभरोदूमिन्नां भारतीं भरताहृते ।  
श्रीमतः कालिदासस्य विजातुं कः क्षामः पुमान् ॥२६॥

सं.

२०	कोईनु	२४	कोईनु
२१	कोईनु	२५	कोईनु
२२	कोईनु	२६	स्थिर देव श्रू मेधदूतनी ८५।५०
२३	कोईनु		

(२७) अपशब्दशातं माघे भारवौ च शतक्यम् ।  
कालिदासे न गण्यन्ते कविरेकः धनंजयः ॥

(तेलुं पाठांतर)

आपशब्दशातं माघे भारवौ च शतक्यम् ।  
कालिदासे न गण्यन्ते कवौ हैकं धनंजये ॥२७॥

### २७ भोज अने कालिदासम्

तेने विषेनो प्रसंग ऐवो छे के कविनो व्हेष करनारा धर्मज्याश्च ।  
कृष्णो भोजराजनी समाप्ते तेनुं स्थान नीयु पडे ले माटे सतत प्रयत्न करता  
रहेता । ऐक दिवस धनंजये उपर्युक्त श्लोक लिखी ऐक विषयने भोजराज पासे  
भोक्त्यो । भार्गमा कालिदासे तेने कल्पु के आमा तारा गुरुनी ऐक खूल थह  
छे । ले तेने छे लेवो ज राज पासे लह ज्ञेता तो तारा गुरुनु खराय हेणाशे ।  
तेमा ईरकारु करी आपवानु कविये कल्पु ते शिष्ये भजूर राख्यु अने थोडाक ।  
ज ईरकारथी : अप शब्द "ने वद्देश्य" ने "पाणीनो शब्द वतावनाराराः शब्द"  
ऐवो शब्द थह गयो अने कालिदासनुं स्थान हुं ते ज रक्षि आ तो क्षित्यत  
कथा छे पशु ते कालिदास विषे तेना रथनाकारुमा शो घ्यात हतो ते  
वतावे छे ।

२६. Wouldst thou the young year's blossom  
                 and the fruit of its decline,  
         And all by which the soul is charmed,  
                 Enraptured, feasted, fed,  
         Wouldst thou the earth and heaven  
                 in one name combine ?  
 २७. I name thee, O Shakuntala,  
                 and all at once is said !

२८. Kalidasa is the pride of Indian Poets  
 ३०. Our illustrious poet, the Shakespear of India

---

२८. જમન મહાકવિ ગટેની અજલિ - શ્રી હ. બી. હસોવીનું  
 ભાષાંતર

२९. પ્રા. સ્ત ગાજી-ક ગડકર - શાકુનતલનું ર્ંપાણ :  
 પ્રસ્તાવના

३०.  
 આ ઉપરાંત કવિવર રવી-કનાથ ઠાકુર : પ્રાચીન માન્દ્રાણિ  
 અને કાલ્યોમાં, શ્રી અરવિંદ (Kalidasa ni)  
 માં ભાઉદાળ રાઈડર, સિલ્વાંદેની, લોસેન અને બીજ  
 અનેક વિદ્વાનોએ પણ મહાકવિ કાલિદાસને અજલાઓ  
 આપેલી છે. વિસ્તારમાંથે આટલેથી જ અટકવાનું ચોંચ  
 માન્યું છે.